

મર્ડરના ગુનામાં પેરોલ જમ્પ થઈ હાઈવે પર ટ્રકોને આંતરી લુંટ ચલાવતા
રીઢા ગુનેગારોને ઝડપી પાડતી કાઈમ બ્રાંચ, સુરત શહેર.

સુરત શહેરમાં મિલકત સંબંધી ગુનાઓ તથા હાઈવે પર થયેલ લુંટના ગુન્હાઓ શોધી કાઢવા સારૂ કાઈમ બ્રાંચના પોલીસ માણસો શહેર વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા. દરમ્યાન ASA સંજય મુરલીધર તથા H.C. રવિન્દ્ર પંડીત નાઓને મળેલ બાતમી આધારે આરોપી (૧) શિવરાજસિંહ ઉર્ફે શીવો ભુપતસિંહ ઝાલા ઉ.વ. ૨૧ ધંધો- બેકાર, રહેવાસી- મ.નં. ૮૦૪/૧, પંચશીલનગર ઉમિયા માતાના મંદિર પાસે, કિન્નરી ટોકીઝની સામે, ભાઠેના, સુરત શહેર. મુળવતન- ગામ- અડવાળ તાલુકો- લીમડી જીલ્લો-સુરેન્દ્રનગર (૨) રવિ ઉર્ફે ડાન્સર સમાધાન લોખંડે (માંગ) ઉ.વ. ૨૫ રહેવાસી- ડી/૧૬, રૂમ નં.૨, ભેસ્તાન આવાસ, સુરત શહેર. મુળવતન- ગામ- નાવલી, તા,જીલ્લો, વાસીમ મહારાષ્ટ્ર નાઓને ઝડપી પાડી તેમની અંગઝડતી માંથી રોકડ રૂપિયા-૦૧,૧૧,૦૦૦/- તથા છરા નંગ-૦૨ તથા કાળા કલરની બેટરી નંગ-૦૧ તથા તેના કબ્જાની નંબર પ્લેટ વગર ૨૨૦ પલ્સર મો.સા. કિ.રૂ.૭૫,૦૦૦/- મળી કુલ્લે કિ.રૂ.૦૧,૮૬,૦૦૦/-ની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરવામાં આવેલ છે. મજકુર બંને આરોપીઓની પુછપરછ કરતા તેણે એકરાર કરેલ કે તારીખ ૨૨/૦૬/૨૦૧૯ ના રોજ વહેલી સવારે બંને જણાએ ૨૨૦ પલ્સર મો.સા. લઈ ઈચ્છાપોરથી ભાઠા જવાના હાઈવે ઉપર MH પાર્સીંગવાળી ટ્રકની આગળ મો.સા. લાવી ઉભી રખાવી ટ્રકના કેબીનમાં ચઢી, છરા બતાવી લુંટી, મો.સા. પર નાસી ગયેલ હોવાનું જણાવેલ તેમજ ગઈ તા.૨૩/૦૬/૨૦૧૯ ના રોજ રાત્રીના સાડા અગીયારેક વાગ્યાની આસપાસ ખટોદરા રકતદાન કેન્દ્ર સામે ફોર વ્હિલર ગાડીવાળા ઈસમો સાથે ગાળાગાળી કરી, લાકડીના ફટકા વડે મારા મારી કરેલ હોવાનું જણાવેલ જે બાબતે (૧) ઈચ્છાપોર પો.સ્ટે. ૧ ગુ.ર.નં. ૩૯/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૯૨,૩૯૭,૩૪૧ તથા આર્મ્સ એક્ટ કલમ ૨૫(૧)(૧-એ) તથા જી.પી.એક્ટ કલમ ૧૩૫ મુજબ (૨) ખટોદરા પો.સ્ટે. ૧૧ ગુ.ર.નં. ૩૮૪/૨૦૧૯ ઈ.પી.કો. કલમ ૩૨૩,૫૦૪,૫૦૬(૨),૧૧૪ મુજબના ગુન્હાઓ નોઘવામાં આવેલ જે વણશોઘાયેલ હોય જે ગુન્હો શોધી કાઢી પ્રસંશનીય કામગીરી કરવામાં આવેલ છે.

આરોપીનો પૂર્વ ઈતિહાસ:-આરોપી શિવરાજસિંહ ઉર્ફે શીવો ભુપતસિંહ ઝાલા અગાઉ નીચે મુજબના ગુનામાં પકડાયેલ છે.

(૧) ઉમરા પો.સ્ટે. ૧ ગુ.ર.નં. ૩૬/૨૦૧૫ ઈ.પી.કો. કલમ ૩૭૯,૩૫૬,૧૧૪ મુજબ. (૨) ખટોદરા પો.સ્ટે. ૧ ગુ.ર.નં. ૬૫/૨૦૧૬ ઈ.પી.કો. કલમ ૩૦૨,૧૪૩,૧૪૭,૧૪૮,૧૪૯,૧૨૦(બી) મુજબ.